

સંપત્તિ(ઓ) ના ટ્રાન્સફરના પ્રભાવની સમજૂતી

તબીબી સહાયતા પાત્રતા વિશે

આ સમજાવે છે કે સંપત્તિનું ટ્રાન્સફર તબીબી સહાય માટેની તમારી પાત્રતાને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. સંપત્તિમાં તમારી અને તમારા જીવનસાથીની બધી આવક અને સંસાધનો શામેલ છે, જેમાં એવી કોઈપણ આવક અથવા સંસાધન સમાવેશ થાય છે જે તમે અથવા તમારા જીવનસાથી મેળવવા માટે હકદાર છો પરંતુ તમારા અથવા તમારા જીવનસાથી દ્વારા કોઈપણ કાર્યવાહી અથવા નિષ્ક્રિયતાને કારણે પ્રાપ્ત થતા નથી. ટ્રાન્સફર એ છે જ્યારે સંપત્તિ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને આપવામાં આવે છે અથવા વેચવામાં આવે છે. તબીબી સહાયના હેતુઓ માટે, નીચેના માટે લાયક બનવા માટે પ્રતિબંધિત ટ્રાન્સફર એ બદલામાં સમાન અથવા વધુ મૂલ્યનું કંઈક પ્રાપ્ત કર્યા વિના, (વળતર વિના) સ્વૈચ્છિક રીતે તમારી સંપત્તિ અન્ય વ્યક્તિને આપવી અથવા વેચવી છે:

- માનસિક વિકલાંગતા ધરાવતા લોકો માટે કુશળ નર્સિંગ સુવિધાઓ અથવા મધ્યવર્તી સંભાળ સુવિધાઓ (માનસિક વિકલાંગ લોકો માટે મધ્યવર્તી સંભાળ સુવિધાઓ, ICF/MR) માં આપવામાં આવતી સેવાઓ,
- હોસ્પિટલમાં સ્વિંગ બેડ અથવા અયોગ્ય સ્તરના કેર બેડમાં આપવામાં આવતી સેવાઓ,
- સમુદાય વૈકલ્પિક પ્રોગ્રામ (CAP) અથવા વૃદ્ધો માટે સર્વસમાવેશક સંભાળ પ્રોગ્રામ (PACE) દ્વારા આપવામાં આવતી સેવાઓ,
- ઉપરોક્ત કોઈપણ સેવાઓ પ્રાપ્ત કર્યા પછી ઘરેલુ આરોગ્ય સેવાઓ અને સપ્લાઇમાં.

તબીબી સહાય તમારી અને તમારા જીવનસાથીની બધી આવક અને સંસાધનોની 36 મહિનાથી 60 મહિના સુધીના સમયની સમીક્ષા કરશે જેથી નક્કી કરી શકાય કે ટ્રાન્સફર થયું/થઈ છે કે નહીં.

વળતર વિનાનું ટ્રાન્સફર થયું છે કે કેમ તે નક્કી કરવા માટે, અમે તે ટ્રાન્સફર સમયે સંપત્તિનું વાજબી બજાર મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ. અમે સંપત્તિ પરની કોઈપણ બાકી લોન, ગીરો અથવા અન્ય કાનૂની બોજો અને સંપત્તિના બદલામાં મળેલા વળતરની રકમ બાદ કરીએ છીએ. પરિણામ, જો કોઈ હોય તો, વળતર વિનાની ટ્રાન્સફર રકમ છે.

કેટલીક ટ્રાન્સફરો તબીબી સહાયને પ્રભાવિત કરતી નથી:

1. સંપત્તિ(ઓ) તમારા જીવનસાથીને (અથવા માત્ર તમારા જીવનસાથીના લાભ માટે બીજાને) અથવા તમારા જીવનસાથી પાસેથી તમને ટ્રાન્સફર કરવામાં આવી હતી; અથવા
2. માત્ર તમારા જીવનસાથીના લાભ માટે સંપત્તિ(ઓ) તમારા જીવનસાથી પાસેથી બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી હતી; અથવા
3. આ સંપત્તિ(ઓ) તમારા કોઈપણ વયના બાળકને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેને સામાજિક સુરક્ષા વહીવટીતંત્રે અંધ અથવા અપંગ જાહેર કર્યું હોય અથવા ફક્ત તે બાળકના લાભ માટે સ્થાપિત ટ્રસ્ટને ટ્રાન્સફર કરવામાં આવી હતી; અથવા
4. ટ્રાન્સફર કરેલી સંપત્તિ તમારા ઘરની જગ્યા હતી અને ઘરની જગ્યા આ વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી હતી:
 - a) તમારા જીવનસાથી; અથવા.
 - b) તમારું સગીર બાળક અથવા 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, અથવા તમારું બાળક અથવા કોઈપણ ઉંમરના બાળકો જેમને સામાજિક સુરક્ષા વહીવટીતંત્રે અંધ અથવા અપંગ જાહેર કર્યા છે; અથવા.
 - c) તમારા ભાઈ કે બહેન કે જેમનો પણ ઘરમાં સરખો હિસ્સો પણ છે અને તમે નર્સિંગ સુવિધામાં પ્રવેશ કર્યો હોય અથવા CAP અથવા PACE ની વિનંતી કરી હોય તે સમયના તરત પહેલાથી ઓછામાં ઓછા એક વર્ષથી ઘરમાં રહે છે.
 - d) તમારું બાળક અથવા એવા બાળકો કે જેઓ તમે નર્સિંગ સુવિધામાં પ્રવેશ્યાના તરત પહેલા ઓછામાં ઓછા બે વર્ષથી ઘરમાં રહેતા હતા અથવા CAP અથવા PACE ની વિનંતી કરી હતી અને તમને એવી સંભાળ પૂરી પાડી હતી જેનાથી તમે 2 વર્ષના સમયગાળા દરમિયાન નર્સિંગ સુવિધામાં રહેવાને બદલે ઘરે રહી શકો. પુખ્ત વયના બાળક અથવા બાળકોએ જરૂરી સંભાળ પૂરી પાડી તે બે વર્ષ દરમિયાન પુખ્ત વયનું બાળક અથવા બાળકો ઘરમાં રહ્યા હતા તે દસ્તાવેજો પૂરા પાડવા આવશ્યક છે.

જો ટ્રાન્સફર થયું હોય તો કવરેજ કેવી રીતે નક્કી થાય છે:

જ્યારે તમે અથવા તમારા જીવનસાથી સંપત્તિનું તેમના મૂલ્ય કરતાં ઓછા ભાવે ટ્રાન્સફર કરો છો, ત્યારે તમે એક સમયગાળા માટે ઉપરોક્ત સૂચિબદ્ધ સેવાઓ માટે Medicaid મેળવી શકતા નથી, જે ટ્રાન્સફર કરેલી સંપત્તિના મૂલ્યના આધારે નિર્ધારિત થાય છે. ખાનગી નર્સિંગ હોમ કેર માટેના સરેરાશ માસિક ખર્ચ દ્વારા ટ્રાન્સફર કરાયેલી સંપત્તિ(ઓ) ના વળતર વિનાના મૂલ્યને વિભાજિત કરીને અમે નક્કી કરીએ છીએ કે તમે કેટલા મહિના આ સેવાઓ મેળવવા અયોગ્ય છો. **1 નવેમ્બર, 2007 પહેલાના ટ્રાન્સફર માટે,** મંજૂરીનો સમયગાળો તે મહિનાના પ્રથમ દિવસથી શરૂ થાય છે જેમાં સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવી હતી. **1 નવેમ્બર, 2007 ના રોજ અથવા તે પછીના ટ્રાન્સફર માટે,** મંજૂરીનો સમયગાળો તે મહિનાના પહેલા દિવસે શરૂ થાય છે જેમાં તમે સંસ્થાકીય રીતે દાખલ થાઓ છો અને અન્યથા સંસ્થાકીય સેવાઓ (ઉપર ઉલ્લેખિત) ની Medicaid યુકવણી માટે પાત્ર હશો, જે પણ પછી હોય, અને તે અન્ય કોઈપણ અયોગ્યતાના સમયગાળા દરમિયાન આવતો નથી.

અન્ય કયા ટ્રાન્સફર તમારી Medicaid પાત્રતાને પ્રભાવિત કરતા નથી?

જો તમે અથવા તમારા જીવનસાથીએ વાજબી બજાર મૂલ્ય કરતાં ઓછી કિંમતે સંપત્તિ ટ્રાન્સફર કરી હોય, તો પણ તમે ઉપરોક્ત સૂચિબદ્ધ સેવાઓ માટે Medicaid કવરેજ મેળવી શકો છો જો તમે સાબિત કરી શકો કે:

1. તમે અથવા તમારા જીવનસાથી વાજબી બજાર મૂલ્ય પર સંપત્તિ(ઓ)નો નિકાલ કરવાનો ઇરાદો ધરાવતા હતા; અથવા
2. સંપત્તિ(ઓ) ફક્ત Medicaid કવરેજ માટે લાયક બનવા સિવાયના હેતુ માટે ટ્રાન્સફર કરવામાં આવી હતી; અથવા
3. બધી ટ્રાન્સફર કરેલી સંપત્તિ(ઓ) પરત કરવામાં આવી છે.

ઉપરોક્ત 1 અથવા 2 માં વર્ણવેલ પુરાવાઓની ગેરહાજરીમાં, જો કાઉન્ટી ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સર્વિસીસ દ્વારા નક્કી કરવામાં આવે કે સંસ્થાકીય સેવાઓ માટે કવરેજનો આ ઇનકાર તમારા માટે અયોગ્ય મુશ્કેલીમાં પરિણમશે, તો અમે સંસ્થાકીય સેવાઓ માટે Medicaid કવરેજનો ઇનકાર કરીશું નહીં. તમારે મુશ્કેલી સમીક્ષાના અધિકારની સૂચના મળ્યાના 12 કેલેન્ડર દિવસોમાં અયોગ્ય મુશ્કેલીના નિર્ણયની વિનંતી કરવી આવશ્યક છે. જો તમે દસ્તાવેજો સાથે દર્શાવી શકો તો અમે તમારી અયોગ્ય મુશ્કેલી માટેની વિનંતી પર વિચાર કરીશું:

1. તમને યોગ્ય તબીબી સંભાળથી વંચિત રાખવામાં આવશે જેના વિના તમારા સ્વાસ્થ્ય અથવા જીવનને જોખમ થશે અને તમારા ડોક્ટર આ લેખિતમાં પ્રમાણિત કરે છે, અથવા
2. તમને ખોરાક, કપડાં, રહેઠાણ અથવા જીવનની અન્ય મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રાખવામાં આવશે અને તમારા ડોક્ટર અથવા અન્ય જાણકાર વ્યક્તિ લેખિતમાં પ્રમાણિત કરશે કે આ વિના તમારા સ્વાસ્થ્ય અથવા જીવનને ગંભીર જોખમ છે, અને
3. તબીબી સંભાળ, ખોરાક, કપડાં, આશ્રય અને જીવનની અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે અન્ય કોઈ સ્ત્રોત ઉપલબ્ધ નથી, અને
4. તમે દર્શાવો છો કે તમે સંસાધનો પુનઃપ્રાપ્ત કરવા માટે સદ્ભાવનાપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તે દર્શાવી શકો છો કે તે પુનઃપ્રાપ્ત કરી શકાતા નથી.

તમને કયા અધિકારો છે?

તમને તમારા Medicaid નિર્ણય અંગે લેખિત સૂચના પ્રાપ્ત થશે. તમને અમારા નિર્ણય સામે અપીલ કરવાનો અધિકાર છે. અમારી લેખિત સૂચના તમને અપીલની વિનંતી કેવી રીતે કરવી તે વિશે માહિતી પ્રદાન કરશે.